

Date: May 17, 2024

To
Bombay Stock Exchange Limited
Department of Corporate Services,
PhirozeJeejeebhoy Towers,
Dalal Street,
Mumhai — 400001

Scrip Code: 544106 | Symbol: MCFL

<u>Subject: Newspaper Advertisement - Results for the half year and year ended</u> March 31, 2024

Dear Sir/ Madam,

Pursuant to Regulations 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the newspaper advertisement for the Financial Results of Mayank Cattle Food Limited, for the half year and financial year ended March 31, 2024, published on May 17, 2024 in the following newspapers:

- a. Financial Express
- b. Gujarat Mirror

These are also being made available on the Company's website at www.mayankcattlefood.com.

We request you to kindly take the above information on record.

Thanking You. Yours faithfully,

For MAYANK CATTLE FOOD LIMITED

AJAY POPATLAL VACHHANI WHOLE-TIME DIRECTOR (DIN:00585290)

Date: 17.05.2024 Place: Rajkot



NMDC Limited (A Government of India Enterprise)

Corporate Identity Number: L13100TG1958 GOI 001674

Donimalai Complex Donimalai Township - 583 118, Dist: Ballari, Karnataka. Phone: 08395-274638 274624, Fax: 08395 - 274009, 274649

EOI NO-DNM/PPT/EOI-1/2024 Date: 16.05.2024 EXPRESSION OF INTEREST NOTICE (EOI) tem Description: THE WORK OF OPERATION AND MAINTENANCE OF

1.2MTPA PELLET PLANT (1.89MTPA BENEFICIATION PLANT and 1.2MTPA PELLET PLANT & MRSS) FOR PRODUCTION OF 12,00,000 METRIC TON PER YEAR OF IRON ORE PELLETS ON PROFIT SHARING/REVENUE SHARING BASIS FOR A PERIOD OF TEN (10) YEARS AT 1.2 MTPA PELLET PLANT, DONIMALAI, KARNATAKA FOR MAKING IRON CONCENTRATE AND FINAL SALEABLE PELLETS. Prospective Bidders having relevant experience of providing services of similar nature are invited to submit their application by 6"June, 2024 to be followed by participation in discussion Presentation meeting at Pellet Plant, NMDC Ltd. Donimalai. Please refer to the EOI Document hosted on the website http://www.nmdc.co.in/nmdctender/ default.aspx and also in CPP Portal for further details. For further clarifications. The Project Manager, Pellet Plant, Donimalai Complex, Donimalai Township, Dist. Bellary Kamataka. 582118 or at gvrao@nmdc.co.in and srikanth.y@ For and on behalf of NMDC Ltd. Project Manager, Pellet Plant

E-AUCTION SALE NOTICE FOR SALE OF ASSETS OF EXCEL GLASSES LIMITED (In Liquidation) Registered Office: Udaya Nagar, Pathirapally, Alappuzha, P. O. Alleppey, Kollam - 688521, Keral CIN: L26109KL1970PLC002289

(Sale of Assets under Insolvency and Bankruptcy Code, 2016)

recourse basis". Sale will be done by the undersigned through E- Auction service provider Nationa

The undersigned Liquidator of Excel Glasses Limited (Corporate Debtor In Liquidation) appointed by he Hon'ble NCLT, Kochi Bench, vide order dated 21.10.2019, intends to sell the following mmovable properties forming part of the Liquidation Estate of the Corporate Debtor through 8 auction on "as is where is basis", "as is what is basis", "whatever there is basis" and "without

 Governance Services Ltd (NeSL) (website: https://nbid.nesl.co.in/app/login). Date and Time of 22nd E-auction: Wednesday, 19th June, 2024, 3 PM to 5 PM Up to Thursday, 6th June, 2024 by 5 PM Last Date and Time for submission of EOI including KYC documents, Eligibility Criteria

documents, etc. by the Prospective bidder. Date of declaration of Qualified Bidder(s) Up to Friday, 7th June, 2024 Date and Time for Inspection/due diligence Up to Friday, 14th June, 2024 (with one-day of assets under auction by the Qualified prior intimation to Mr. Sudhanshu Pandey -

Last date for submission of Declaration

Land Area - 1.22 acres - 4.937 sq mts

Bidder(s):

Up to- Friday, 14th June, 2024 by 3 PM Forms and Earnest Money Deposit EMD (10% of Description (Assets) No. Price (Rs. Reserve Price) in lakhs) (Rs. in lakhs) Block Land opposite to Infocity Campus, Pallipuram Village, 92.70 9.27 Cherthala Taluk, Alappuzha, Kerala - 688541 -

Mob. - 9821916190 11:00 am - 3.30 pm

(except Sundays and Kerala State Holidays).

Interested Bidder/s may refer to detailed terms and conditions and tender documents (Sale Proces Memorandum) through websites: https://nbid.nesl.co.in/app/login and http://www.excelglasses.com and can also visit www.ibbi.gov.in for the sale auction notice. They can contact through Email: araventhanse@nesl.co.in , ipsupport@nesl.co.in , sankar@nesl.co.in neeld@nest.co.in or write to the undersigned at ip.ravinchaturvedi@gmail.com, contact numbers Mr. Araventhan SE +91- 9384676709, Mr. Neel Doshi +91- 9404000667 or can contact M Sudhanshu Pandey Mob. No. +91-9821916190.

The Liquidator has the absolute right to accept or reject any or all offer(s)/bids or adjourn/postpone/cancel the E- auction or withdraw any property or portion thereof from the auction roceeding at any stage. Any revision in the sale notice will be uploaded on the Excel Glasses Limited website http://www.excelglasses.com and on https://nbid.nesl.co.in/app/login . It is requested to all the bidders to kindly visit the website regularly.

Place: Mumbai Ravindra Chaturved Date: 17.05.2024 Liquidator of Excel Glasses Limited (In Liquidation)

IBBI Reon, No. IBBI/IPA-001/IP-P00792/2017-18/11359 (AFA valid upto 19.11.2024) Address: 31-E, BKC Centre, Laxmi Industrial Estate, New Link Road Andheri (West), Mumbai - 400053

NOTICE OF SALE OF ASSETS OF SNNEHA NATURAL WORLD PRIVATE LIMITED (in Liquidation) Factory at: Plot No. 1B, Sector I, Phase III, Gat No. 50, 51, 52 and 53, Parvati Coop.

Indl Estate Ltd, Yadrav, Ichalkaranji, Kolhapur – 416146. **Regd. Off. At :** Flt 26-A, 1st Fir, A-3, Narayan P Chandivali Road, Off Sakivihar, Sakinaka, Mumbai 400072, MH, India

(Sale under Insolvency and Bankruptcy Code, 2016) The undersigned Liquidator of Snneha Natural World Private Limited (In Liquidation) ('Corporate

Debtor'), appointed by the Hon'ble NCLT, Mumbai, vide order dated 28.07.2021, intends to sell the following immovable properties forming part of the liquidation estate of Corporate Debtor through e auction on "as is where is basis", "as is what is basis", "whatever there is basis" and "without recourse basis". Sale will be done by the undersigned through E-Auction service provider i.e. M/S National E-Governance Services Ltd (NeSL) (website: https://nbid.nesl.co.in/app/login) Date and Time of 19th E-auction Wednesday 19th June 2024 3 PM to 5 PM

Sr. Sr.	Reserve EMD (5% of				
Last date for submission of Declaration Forms and Earnest Money Deposit (EMD)	Up to Friday, 14th June, 2024 (with one-day prior intimation to Mr. Sudhanshu Pandey – Mob. – 9821916190 11:00 am - 3,30 pm (except Sundays and Maharashtra State Holidays). Up to Friday, 14th June, 2024, by 3 PM				
Date and Time for Inspection/due diligence of assets under auction by the Qualified Bidder(s)					
Date of declaration of Qualified Bidder(s)	Up to Friday, 7th June, 2024				
Last Date and Time for submission of EOI including KYC documents, Eligibility Criteria documents, etc. by the Prospective bidder.					
Date and time of 19th E-duction	Viculiaday, 18th 2016, 2024, 3 FM to 3 F				

Sr. No.	Description (Assets)	Control of the Contro	EMID (5% of Reserve Price (Rs. in lakhs
Block 1	Leasehold Factory Land admeasuring area about 22,000 Sq.mt covering situated at Plot No. 1-B and 1-C, Village-Yadrav, Gut No. 50,51,52 and 53, Parvati Co-Operative Industrial Estate, Sector-I, Phase-III, Taluka-Shirol, District-Kolhapur, within the local limits of Shirol. And Building admeasuring approximate built-up area is 46,246,50 Sq. Ft. situated at Plot No. 1-B and 1-C, Village-Yadrav, Gut No. 50,51,52 and 53, Parvati Co-Operative Industrial Estate, Sector-I, Phase-III, Taluka-Shirol, District-Kolhapur, within the local limits of Shirol.	20000000	30.50

Bidder's may refer to detailed terms and conditions and tender documents (Process Memorandum through websites: https://nbid.nesl.co.in/app/login and can also visit www.ibbi.gov.in for the sale auction notice. They can contact through Email: araventhanse@nesl.co.in , ipsupport@nesl.co.in , sankar@nesl.co.in , neeld@nesl.co.in or write to the undersigned at snnehaworld@gmail.com contact numbers: Mr. Araventhan SE +91- 9384676709; Mr. Neel Doshi +91- 9404000667 or can contact Mr. Sudhanshu Pandey Mob. No. +91-9821916190.

The Liquidator has the absolute right to accept or reject any or all offer(s)/bids or adjourn/postpone/cancel the e-Auction or withdraw any property or portion thereof from the auction proceeding at any stage. Any revision in the sale notice will be uploaded on the website on https://nbid.nesl.co.in/app/login.lt is requested to all the bidders to kindly visit the website regularly. Place: Mumbai

Date: 17.05.2024 Ravindra Chaturvedi Liquidator of Snneha Natural World Private Limited(In Liquidation) IBBI Regn. No.: IBBI/IPA-001/IP-P00792/2017 2018/11359 AFA Valid up to 19.11.2024 Address: 31-E, BKC Centre, Laxmi Industrial Estate, New Link Road

Mavank CIN: L01210GJ1998PLC033969

MAYANK CATTLE FOOD LIMITED

Read, Office: R.S. No. 162, Raikot Jamnagar Highway, Near Khandheri Stadium. Vill. Naranka, Tal. Paddhari, Rajkot, Gujarat, 360110, India. E-mail: info@mayankcattlefood.com • Website: www.mayankcattlefood.com

EXTRACT OF STATEMENT OF FINANCIAL RESULTS FOR THE HALF YEAR ENDED AND YEAR ENDED 31 MARCH, 2024 (AUDITED)

Sr.	Particulars		Half Year End	Year ended		
No.		31.03.2024	30.09.2023	31.03.2023	31.03.2024	31.03.2023
110.	A DALL BRIDGE CONTRACTOR CONTRACT	Audited	Audited	Audited	Audited	Audited
1	Total Income From Operations	17,346.07	11,683.44	13,506.32	29,029.51	30,918.05
2	Net Profit / (Loss) Before Tax	232.60	167.50	108.54	400.10	171.52
3	Net Profit / (Loss) After Tax	191.85	101.58	79.96	303.43	127.25
4	Paid-up equity share capital	540.00	360.00	20.00	540.00	20.00
5	Reserves (Excluding Revaluation Reserves	2,150,33	227.57	455.99	2,150.33	455.99
6	& Government Grant)	2,150.33	221.51	400.99	2,100.33	400.99
0	Earnings Per Share (EPS) not annulized (FV. Rs. 10/- each)					
	Basic (in Rs.)	4.93	2.82	2.22	7.80	3.53
	Diluted (in Rs.)	4.93	2.82	2.22	7.80	3.53

1 The above Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 16 May, 2024. The statutory auditors of the company have carried out limited review of the financial results for the half year ended 31 March 2024.

2 The Above Financial Results have been prepared in accordance with the applicable Accounting Standards as prescribed u/s. 133 of the Companies Act, 2013 read with relevant provision of the Act as amended and other recognized accounting practices and policies to the extent applicable

3 The above is an extract of the detailed format of audited financial results for the half year and year ended 31st March, 2024 filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of the audited financial results for the half year and year ended 31st March, 2024 are available on the Company's website at www.mayankcattlefood.com and on the website of the Stock Exchange at www.bseindia.com. Previous periods / years' figures have been re-grouped / re-classified, where necessary to make it comparable with the current period.

Ajay P. Vachhani Place: Rajkot Whole time directior . DIN - 00585290 Date: 16 May, 2024

BATA INDIA LIMITED

CIN: L19201WB1931PLC007261 Registered Office: 27B, Camac Street, 1st Floor, Kolkata - 700016, West Bengal Telephone No.: 033 23014400 | Fax: 033 22895748 Share Dept. Telephone No.: 033 22895796

NOTICE TO THE SHAREHOLDERS

Sub.: Transfer of Equity Shares held in Bata India Limited ("the Company") to the Demat Account of the 'Investor Education and Protection Fund Authority - Ministry of Corporate Affairs' (IEPF), in respect of which dividend remaining unclaimed or unpaid for the seven consecutive years

This is further to our individual communication to the concerned shareholders at their latest available

E-mail: share.dept@bata.com | Website: www.bata.in

addresses in terms of Section 124(6) of the Companies Act, 2013 (as amended) ("the Act") read with IEPF Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (as amended) ["IEPF (AATR) Rules, 2016"] and other applicable rules, notifications and circulars, if any, requiring every company to transfer the shares, in respect of which dividend remains unpaid / unclaimed for a period of seven (7) consecutive years to the Demat Account of the IEPF Authority ("the IEPF Demat Account").

In this regard, Notice is hereby given to the shareholders holding shares relating to which they have not encashed their dividend since 2016-17 (i.e. none of the dividend(s) declared since 2016-17 were claimed/encashed), that such shares are liable to be transferred by the Company under the IEPF Rules to the IEPF Demat Account. Necessary details in this respect are available at www.bata.in under the 'Investor Relations' section for taking appropriate action.

The shareholders of the Company who have not encashed their dividend are being given an opportunity, as per the prescribed Rules, for claiming their dividend by making a written application under physical signature(s), giving complete postal address alongwith Pin Code and Folio No. / DP ID & Client ID together with a cancelled original cheque leaf of the Bank account bearing the name of the first / sole holder, details of Bank, Branch, Account Number, MICR code, IFSC code, etc., failing which copy of Bank passbook / statement duly attested by the Bank (not more than one month old) with all such required details and self-attested copy of Income Tax PAN card(s) of registered shareholder(s), i.e., including joint holder(s) to the Company at its Registered Office or to M/s. Link Intime India Private Limited, Registrar and Share Transfer Agent (RTA) of the Company.

You are further requested to register your email ID with the demat account through your Depository Participant (DP) immediately against shareholding in demat mode.

In order to comply with the IEPF Rules, the Company will proceed to transfer the equity shares to the IEPF Demat Account unless a valid claim is received by the Company/its Registrar and Share Transfer Agent by 15/06/2024. Thereafter no claim shall lie against the Company in respect of such shares transferred to IEPF Demat Account pursuant to the IEPF Rules.

The Shareholder(s), whose equity shares are liable to be transferred to the IEPF Demat Account, may kindly note that as per the IEPF Rules:-

- In case of Equity Shares held in Physical form: Duplicate share certificate(s) will be issued and the concerned depository shall convert the duplicate share certificate(s) into Demat form and shall transfer the shares in favour of the IEPF Demat Account. The original share certificate(s) registered in the shareholders' names will stand automatically cancelled and deemed nonnegotiable.
- In case of Equity Shares held in Demat form: Concerned depository will give effect to the transfer of the equity shares liable to be transferred in favour of the IEPF Demat Account by way of corporate action.

The shareholders may please note that unclaimed / unpaid dividend and equity shares transferred to the IEPF Demat Account including benefits accruing on such equity shares, if any, can be claimed from the IEPF Authority by making an online application in the prescribed web Form IEPF-5 (available on the website www.iepf.gov.in / the webpage address for the said web Form is also given on our website www.bata.in) and thereafter sending its duly signed (as per the specimen signature recorded with the Company/Depository) physical copy alongwith the requisite documents enumerated in Form IEPF-5 to the Company for verification. For further information/ clarification, contact at any of the following addresses:

BATA INDIA LIMITED Registered Office & Share Department: 27B, Camac Street, 1st Floor, Kolkata - 700016 Telephone: 033 22895796; Fax: 033 22895748	Mumbai - 400083
E-mail: share.dept@bata.com	Telephone: 8108116767; Fax: 022 49186060
Website: www.bata.in	E-mail: rnt.helpdesk@linkintime.co.in

NITIN BAGARIA Place: Gurugram Company Secretary & Compliance Officer Date: 16.05.2024



PAUL MERCHANTS LTd. (An ISO 9001:2015 Certified Co.) (CIN: L74900DL1984PLC018679) CORP. OFF.: PML House, SCO 829-830, Sector 22 A, Chandigarh 160 022 Ph. 0172 5041786, 5025090, Fax: 0172 5041709 E-mail: info@paulmerchants.net Website: www.paulmerchants.net

REGD. OFF.: DSM 335, 336, 337, 3rd Floor, DLF Tower, 15, Shivaji Marg, Najafgarh Road, New Delhi-110015. Ph: 011-47529460 EXTRACT OF STANDALONE AND CONSOLIDATED RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED ON 31.03.2024

Andheri (W), Mumbai - 400 053

For BATA INDIA LIMITED

See	Regulation 47(1) (b) of the SEBI (LODK) Regulations, 2015](Lis	sting Regulations	5)					ks in Lakns excep	ot per snare data
			Stand	lalone	- 77	Consolidated			
S. No.	Particulars	Three Months Ended 31.03.2024	Corresponding 3 Months Ended in the previous Year 31.03.2023	Current Year to date ended 31.03.2024	Previous Year ended 31.03.2023	Three Months Ended 31.03.2024	Corresponding 3 Months Ended in the previous Year 31.03.2023	31.03.2024	Previous Year Ended 31.03.2023
		Audited	Audited	Audited	Audited	Audited	Audited	Audited	Audited
1	Total Income from operations	85,542.71	166,817.04	650,184.37	689,975.80	90,115.10	169,760.53	666,657.64	701,089.89
2	Net Profit for the period (before Tax, Exceptional and/ or Extraordinary items)	368.67	839.30	3,513.77	3,495.88	1,227.84	1,102.67	7,310.67	5,970.75
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	368.67	839.30	3,513.77	3,495.88	1,227.84	1,094.13	7,280.17	5,962.21
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	279.70	644.20	2,612.48	2,598.40	933.59	843.39	5,462.56	4,401.17
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	280.08	645.66	2,591.62	2,580.64	938.11	844.67	5,443.57	4,387.44
6	Equity Share Capital	308.40	102.80	308.40	102.80	308.40	102.80	308.40	102.80
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year	NA	NA	47,317.99	44,931.97	NA	NA	56,211.75	50,973.78
8	Earnings Per Share (of Rs. 10 /- each) for continuing and discontinued operations 1. Basic 2. Diluted	9.07 9.07	20.89 20.89	84.71 84.71	84.25 84.25	30.27 30.27	27.35 27.35	177.13 177.13	142.71 142.71

Note: a) The above is an extract of the detailed format of Quarterly and yearly Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (LODR) regulations, 2015. The full format of the quarterly and yearly results are available on the website of BSE Limited http://www.bseindia.com and are also available

on the website of the company http://www.paulmerchants.net b) The Company has adopted Ind-As w.e.f. 01.04.2017. This Statement of Financial Results have been prepared in accordance with Indian Accounting Standards (Ind As) prescribed under the Companies Act, 2013 and Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind-As) alongwith SEBI circular no. CIR/CFD/FAC/62/2016 dated 05.07.2016.

c) The above audited Standalone and Consolidated Financial Results for the Quarter and year ended 31.03.2024 were reviewed and recommended by the Audit Committee in its meeting held on 15.05.2024. The same have been approved and taken on record by the Board of the Directorts of the Company in their meeting held on 16.05.2024

d) During the year under review, a contingent liability of Rs. 30.5 Lakhs, disclosed in audited financials of Paul Merchants Finance Private Limited (PMFPL) for FY 2022-23, has been paid in full by the said subsidiary on August 28, 2023 upon receipt of final order of the RBI under Para 9.1(ii) (d) of the Master Directions on PPIs dated August 27, 2021. The same is disclosed as an extraordinary item in the standalone financial results of PMFPL as well as the consolidated financial results of the group. The Company does not have any other exceptional or extraordinary items to report for the above period. By order of the Board

Rajneesh Bansal **Managing Director** (DIN-00077230)

Place : Mumbai

Date: May 16, 2024

SUNSHIELD CHEMICALS LTD

EXTR/

SUNSHIELD CHEMICALS LIMITED Corporate Identity Number: L99999MH1986PLC041612

Regd. Office: 1501-A, Universal Majestic, P.L. Lokhande Marg, behind RBK International School Chembur-West, Mumbai - 400 043 | Phone No.: 25550126

E Mail: investorservices@sunshieldchemicals.com | Website: www.sunshieldchemicals.com

ACT OF FINANCIAL RESULTS	FOR THE QUARTE	R AND YEA	R ENDED N	IARCH 31,	2024
		F	Rs. In Lakhs (Except earnir	ngs per share)
Particulars	Quarte	r ended (Una	udited)	Year ende	d (Audited)
Farticulars	Mar 31, 2024 Dec 31, 2023 Mar 31,2023 Mar 31, 2	Mar 31, 2024	Mar 31, 2023		
ne from operations	8,588	6,557	6,721	28,486	24,658
or the period / year before tax	857	729	450	2,674	1,908
	500	27.0	600	4 004	4.000

Total income Net Profit fo Net Profit for the period / year after tax 335 1,884 513 1,366 558 Total Comprehensive Income for the period / year 516 344 1,853 1,379 Paid up equity share capital (face value of Rs. 10/-each) 735 735 735 735 735 Other Equity 7,484 5,865 4.56 25.62 18.58 Basic & Diluted Earnings per Share (of Rs. 10/- each) 8.15 6.97 (not annualised for the guarter) Note:-

1 The aforesaid financial results of Sunshield Chemical Limited (the "Company") were reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors of the Company at its meeting held on May 16, 2024. The same have been audited by the Statutory Auditors who have issued an unmodified opinion on the aforesaid results.

2 The above is an extract of the detailed format of quarterly/ year ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly/ year ended Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and also on the Company's website www.sunshieldchemicals.com

> For and on behalf of the Board of Directors SUNSHIELD CHEMICALS LIMITED Jeet Malhotra Managing Director & CEO DIN: 07208234

> > (Rs. in Lakhs)

Date: May 16, 2024

Place : Mumbai

For, Mayank Cattle Food Ltd.

JHARKHAND ROAD PROJECTS IMPLEMENTATION COMPANY LIMITED Registered Office: 443/A, Road No 5, Ashok Nagar, Ranchi -834002.

http://www.itnlindia.com/JRPICL-SPV.aspx CIN:- U45200JH2009PLC013693

Statement of Financial Results for the quarter and year ended March 31, 2024

Year ended Quarter ended Mar 31, Mar 31, March 31, Dec 31, March 31, **Particulars** 2024 2023 2023 2024 2023 (Unaudited) (Unaudited) (Unaudited) (Audited) (Audited) 7,809 8,467 8,918 35,064 33,434 Total Income from Operations (7,803)(1,488 (5,373) (8,677 1,815 Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) (1,488)Net Profit / (Loss) for the period before tax (after (7,803)(5,373)(8,677)1,815 Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after (7,803)(1,488 (5,373) (8,677 1,815 Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the period (1,488 (5,373) 1,815 (7,803) (8,677 (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)) 25,950 25,950 25,950 25,950 25,950 Paid-up equity share capital (face value - ₹ 10 per share) (44,575 (52,378)(43,701) (52,378)(43,701)Reserves (excluding revaluation Reserve) 8 Securities Premium Amount 9 Net worth (26,428) (18,625) (17,751) (26,428) (17,751)10 Paid-up Debt Capital / Outsatnding Debt 1,74,725 1,72,340 1,89,091 1,74,725 1,89,091 11 Outstanding Redeemable Preference Shares (10.65) (6.61) (9.25)(6.61)(10.65)Debt Equity Ratio (number of times) Earnings per share (of ₹ 10/- each) (for continuing and discontinued operations) (*Not annualised): -0.3* -0.06 -0.21* (3.34)(b) Diluted -0.3* -0.06* -0.21* (3.34)0.70 Capital Redemption Reserve 15 Debenture Redemption Reserve 11,409 11,409 11,409 11,409 11,409 Debt Service Coverage Ratio (DSCR) (number of 0.83 1.60 1.34 17 Interest Service Coverage Ratio (ISCR) (number 0.83 1.88 1.70 of times) Notes to the Financial Results for the guarter and year ended March 31, 2024:

and other disclosure requirements) Regulations, 2015. The full format of the year financials results are available on the websites of the National Stock Exchange (NSE) -www.nseindia.com and the Company's - www.itnlindia.com/JRPICL-SPV.aspx For the items referred in the Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, the

1 The above is an extract of the detailed format of financial results filed with Stock Exchanges under Regulation 52 of the SEBI (Lisiting

pertinent disclosures can be accessed on the (www.nseindia.com) and on the Company's website - www.itnlindia.com/JRPICL-SPV. aspx The above results for year ended March 31, 2024 are in complinace with Indian Accounting Standards ("Ind AS") notified by the

Ministry of Corporate Affairs, read with SEBI Circular No. CIR/CFD/FAC/69/2016 dated August 10, 2016.

The above financial results of the Company for the quarter and year ended March 31, 2024 has been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on May 16, 2024 and have been audited by the Statutory Auditor of the Company.

For and on behalf of the Board

Place: Ahmedabad Date: 16th May 2024 Rajnish Saxena Director DIN: 05188337

HIGHWAYS INFRASTRUCTURE TRUST

HIGHWAYS INFRASTRUCTURE TRUST

SEBI Registration No. IN/InvIT/21-22/0019

Principal Place of Business: 2nd Floor, Piramal Tower, Peninsula Corporate Park, Lower Parel, Mumbai - 400013. Corporate Address: Unit 601-602, 6th floor, Windsor House, Off CST Road, Kalina, Santacruz(E), Mumbai - 400098. Tel: +91 75063 33445 E-Mail: highwaysinvit@highwayconcessions.com Website: www.highwaystrust.com

Extract of Statement of Audited Consolidated Financial Results for the Quarter and Year ended March 31, 2024

Sr.	Particulars	Quarter	(All amour	Year Ended		
or. No.	[1] [2] [2] [2] [2] [2] [2] [2] [2] [2] [2	March	March	March	March	
		31, 2024	31, 2023	31, 2024	31, 2023	
		(Audited)	(Audited)	(Audited)	(Audited)	
1	Total Income from Operations	8,538.30	1,600.34	14,127.92	6,152.35	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	444.34	258.02	1,888.75	964.48	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(3,245.20)	258.02	(1,800.79)	964.48	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(3,213.68)	207.14	(2,009.99)	341.99	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(3,214.18)	207.03	(2,011.04)	342.89	
6	Unit capital	68,590.00	41,550.00	68,590.00	41,550.00	
7	Reserves (excluding Revaluation Reserve)	(42,602.37)	(37,168.34)	(42,602.37)	(37,168.34)	
8	Net worth	25,987.64	4,381.66	25,987.64	4,381.66	
9	Paid up Debt Capital / Outstanding Debt (In times)	1.84	2.81	1.84	2.81	
10	Debt Equity Ratio (In times)	1.44	3.37	1.44	3.37	
11	Earnings Per Units (of Rs. 100/- each)					
П	1. Basic:	(4.72)	0.50	(4.17)	0.82	
	2. Diluted:	(4.72)	0.50	(4.17)	0.82	
12	Debenture Redemption Reserve	-	3 0	- 1	N5	
13	Debt Service Coverage Ratio (In times)	1.31	1.60	1.50	0.20	
14	Interest Service Coverage Ratio (In times)	2.19	2.65	2.55	1.97	
15	Current Ratio (In times)	2.14	2.47	2.14	2.47	
16	Long Term Debt to Working Capital Ratio (In times)	2.83	6.88	2.83	6.88	
17	Total Debts to Total Assets (In times)	0.45	0.62	0.45	0.62	
18	Current Liability Ratio (in %)	16.66%	6.80%	16.66%	6.80%	
19	Debtors Turnover (In times)	891.63	1339.19	754.27	328.47	
20	Bad Debts to Account Receivable Ratio	NA	NA	NA	NA	
21	Inventory turnover *	NA	NA	NA	NA	
22	Operating Margin (in %)	20.24%	37.96%	32.14%	51.28%	
23		-37.64%	12.94%	-14.23%	5.56%	

The Trust does not have any Inventory, therefore Inventory Turnover Ratio is not applicable.

1 The aforesaid results have been reviewed and recommended by the Audit Committee and subsequently approved by the Board at

their respective meetings held on May 16, 2024. 2 The above is an extract of the detailed format of Audited consolidated Financial Results/Information for the Quarter and Year ended March 31, 2024. The full format of the Audited consolidated Financial Results/Information is filed with the Stock Exchange under Regulation 52 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "SEBI LODR Regulations"). Investors can view the full format of the Audited consolidated Financial Results/Information of Highways Infrastructure Trust (the "Trust") for the Quarter and Year ended March 31, 2024 on the Trust's website (www.highwaystrust.com) or on the website of BSE Limited (www.bseindia.com)

For the other line items referred in regulation 52(4) and 54(3) of the Listing Regulations, pertinent disclosures have been made to the BSE Limited and can be accessed on the Trust's

For and on behalf of the Board of Directors Highway Concessions One Private Limited

(Acting as Investment Manager to Highways Infrastructure Trust) Gauray Chandna

Joint CEO & Executive Director DIN: 10312924

| Place: Chandigarh

financial exp.epapr.in

Dated: 16.05.2024



વીરપુરની જલારામ બચત સહકારી મંડળી સ્ક્રીમની આડમાં કરોડોનું કૌભાંડ, એસ.પી.ને રજૂઆત

સંચાલક અનિલ માટિયાએ કુલેકું ફેરવી ઝેરી દવા પી લીધી હતી, અન્ય બે સંચાલકોએ હાથ ઉંચા કરી લીધા

ગુજરાત મિરર રાજકોટ તા.૧૭ વીરપરમાં ડેઇલી બચત સ્કીમ સહિત જુદી જુદી સ્ક્રિમોના નામે ૧૫૦૦ થી વધુ અરજદારો પાસે કરોડો રૂપિયાની ઉઘરાણી કરીને શ્રી જલારામ બચત સહકારી 🛭 મંડળી પેઢીના ત્રણ સંચાલકોએ દેવાળું ફૂંકીને ઉઠી જઈને અરજદારોને ચોક્કસ જગ્યાએ લગાડી દીધા હતા.આ ત્રણેય સંચાલકોએ સગા સબંધીના નામે કરોડોની મિલકતો વસાવી લીધા બાદ અગાઉ ઉઠી ગયેલી જય ખોડિયાર મિત્ર મંડળના રાજ મેવાડા નામે ઠીકરું ફોડીને મુખ્ય સંચાલક અનિલ માટીયાએ ૨૦૨૩ માં ઝેરી દવા પી લઈ સિવિલ હોસ્પિટલમાં નાટયાત્મક હતા.સ્કીમમાં ફસાયેલા પૈસા મુદ્દે સ્થાનિક વિરપુર પોલીસ કોઈ વિરપુરના જલારામ કાર્યવાહી ન કરતી હોય તો વિરપૂરના મહિલા અરજદારે રાજકોટ ગામ્ય એસપી જયપાલસિંહ રાઠોડને લેખિતમાં નરસ્તાની બોરડી સૌ રજૂઆત કરી છે.

જો યોગ્ય સમયમાં એસપી, એસ.ઑ.જી. એલ.સી.બીની ટીમ ન્યાયિક કાર્યવાહી નહિ કરે તો ગુજરાત હાઇકોર્ટના દ્વાર

📕 3ા.૨.૮૦ લાખનો

દા3–બીચરનો જથ્થો

ગુજરાત મિરર, હળવદ તા.૧૭ હળવદની મોરબી ચોકડી નજીક સકેદ માટીની આડમાં ટ્રકમાં લઈ

જવાતા ઈંગ્લીશ દારૂ અને બિયરના જથ્થાને મોરબી એલસીબીની ટીમે

ઝડપી પાડચો છે. મોરબી

એલસીબીની ટીમને બાતમી મળી

હતી કે, માળીયા તરફથી સફેદ માટી

ભરીને આવતા ટક નંબર આરજે-

૧૯-જીઈ-૮૭૬૫માં ભારતીય

બનાવટનો ઈંગ્લીશ દારૂ અને

બિયરનો જથ્થો છે. જે બાતમીના

આધારે વોચ ગોઠવતા મોરબી ચોકડી

જપ્તઃ ટ્રક્યાલકની

પૂછપરછ



છે.ઉદ્યેખનીય છે કે આ ત્રણેય સંચાલકોએ સ્ક્રીમની ડાયરીમાં શ્રી વિશ્વાસે પૈસા લીધા

બાદ અરજદારો સાથે હતો.આ સ્કીમથી ખુદ ભકતોમાં નારજગી પ્રવર્તી રહી છે

કોઈ ઝૂંડે (ધણીધોરી વિનાને સૌ કોઈ લૂંટે)થ આપી ચીમકી એસ.બી.આઈ બેંકની ની કહેવતની માફક વિરપૂર પંથકના ૧૫૦૦

ગ્રામજનો પાસે ડેઇલી બચત જયસુખભાઈ સરવૈયાએ અરજીમાં ખખડાવાની ચીમકી આપી સ્કીમના નામે શ્રી જલરામ બચત જણાવ્યું છે કે અમારા ગામમાં શ્રી

પાસે માળીયા તરફથી સફેદ માટી

ભરી આવતા ટક નંબર આરજે-

૧૯–જીઈ–૮૭૬૫ના ચાલકને ઉભો

રાખી તપાસ કરાતા માટીની આડમાં

સંતાડેલી ૭૦૭ બોટલ દારૂ કિંમત

સહકારી મંડળી લી નામની પેઢીના ત્રણ સંચાલકોએ કરોડોનું ફ્લેકું જલારામ બચત મંડળી લી.ના નામે ફેરવીને સગા સબંધીના નામે

હળવદ પાસેથી સફ્રેદ માટીની આડમાં

ટ્રકમાંથી દારૂ-બીયરનો જથ્થો મળ્યો

મિલકતો વસાવી લીધી છે.આ કેસમાં સ્થાનિક રીતે દાખલ થઈ ગયા વિશ્વાસઘાત કર્યો પોલીસે ફરિચાદ વિરપુર પોલીસે કોઈ કાર્યવાહી કરતી ન હોય न सेता તો મહિલા અરજદાર દ્વારા રાજકોટ ગ્રામ્ય ્રુષ્ણ રોકાણકારોએ એસપી જયપાલસિંહ પ્રાપ્ત વિગતો મુજબ હાઇકોર્ટના દ્વાર રાઠોડને લેખિતમાં રજૂ આત ખખડાવવા છે. વિરપૂરમાં

કાજ લબેન

રૂપિયા ૨,૫૨,૨૮૦ તેમજ ૨૮૮

બીયરના ટીન કિંમત રૂપિયા

૨૮,૮૦૦ અને ટ્રક કિંમત રૂપિયા

૧૫ લાખ મળી કુલ રૂપિયા

૧૭,૮૮,૫૮૦નો મુદ્દામાલ જપ્ત કરી

લી. નામે ડેઇલી બચતની સ્કીમ ચાલતી હતી. આ સ્કીમ અનિલભાઈ માટીયા,લાલભાઈ મેવાડા,ભૂપતભાઈ બાંભવા ચલાવતા હતા.આ સ્કીમમાં ૧૫૦૦ થી વધુ અરજદારો રોકાયેલા હતા.આ બચતમાં અમે પણ સભ્ય હતા.અમે મહિને ૪૦૦૦ ઉઘરાવતા હતા.અમારી બચત સ્કીમની ડાયરીમાં સહી કરી આપતા હતા. અમે રૂ.૧,૦૧, ૫૦૦ નું રોકાણ કરેલું હતું.આ ત્રણેય સંચાલકોએ રાતો રાત તાળાં મારીને ઉઠી ગયા હતા. આ કરોડોના મસમોટા કૌભાંડમાં ત્રણેય આરોપી સામે આઇપીસી ४०६, ४०७, ४२०, १२० जी સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા માંગ છે.ઉલેખનીય છે કે વર્ષ ૨૦૨૩ માં વીરપુર પંથકના ખોડીયાર મિત્ર મંડળના કર્મચારી યુવાને ૧૫૦૦ જેટલા રોકાણકારોને રૂપિયા પરત આપવા જય જલારામ બચત સહકારી મંડળી લી. મંડળના નામે ૧૦૦૦ જેટલા લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. જે રોકાણકારોની ઉઘરાણીથી અનિલ માટીયાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો


(તસવીરઃ ચતુર ઠાકોર)

ટક ચાલક સિયારામ ઉર્ફે મકેશ

બનારામ જાટની અટકાયત કરી હળવદ પોલીસ મથકે લઈ જઈ ગનો

નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

પરિણામોમાં એકનું જ રાજ ધોળકિયા સરકાર A1 ગ્રેડમાં 312 વિ. ઓ સાથે 15 જિલ્લાઓને બોર્ડના ઇતિહાસમાં પ્રથમવાર Std. 10th Result - 2024 592/600 માર્કસ મેળવતા બે વિદ્યાર્થી મहાત આપતી ગુજરાતની એકમાત્ર સ્કુલ Std. 12th Science - 2024 રાજકોટમાંથી માત્ર એક જ વિદ્યાર્થી કે જેમને India First ગજકેટમાં 120 /120 માર્કસ મેળવ્યા



સાયન્સ હોય... કોમર્સ હોય... કે... ધો. 10... અત્ર - તત્ર - સર્વત્ર



દ્યોળકિયા સ્કૂલમાં નાના ધોરણોથી જ બનાવેલા મજબૂત પાચાને લીધે જ આવા તેજસ્વી પરિણામો શક્ય છે.

વાંકાનેરના જોધપરમાં નિદ્રાધીન આધેડનું હૃદચરોગના હુમલાથી મોત

ગુજરાત મિરર, વાંકાનેર તા.૧૭ ઃ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા વાડીએ ખાટલામાં સુતા બાદ જગાડવા છતાં નહિ જાગતા સારવાર માટે

વાકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. વાંકાનેર તાલુકાના પાડીએ ખાટલામાં સુતા બાદ આધેડ જોધપર ગામે રહેતા કાંતિભાઈ કેશુભાઈ સોલંકી હાવાનું સામ આવ્યું હતું. વાકાનર તાલુકાના ઉ.૫૫ પોતાની વાડીએ ખાટલામાં સુતા બાદ **નહીં જાગતા પરિવાર શોકમાં ગરકાવ** કઈ બોલતા ચાલતા ન હોય બેભાન બની જતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે

> **MAYANK CATTLE FOOD LIMITED** Regd. Office: R.S. No. 162, Rajkot Jamnagar Highway, Near Khandheri Stadiul

Vill. Naranka, Tal. Paddhari, Rajkot, Gujarat, 360110, India. E-mail: info@mayankcattlefood.com • Website: www.mayankcattlefood.com

(₹. In Lacs)							
Sr.	NO. 10062 44		lalf Year En	Year ended			
No.	Particulars	31.03.2024	30.09.2023	31.03.2023	31.03.2024	31.03.2023	
110.	2-33-2-33-33-33-33-33-33-33-33-33-33-33-	Audited	Audited	Audited	Audited	Audited	
1	Total Income From Operations	17,346.07	11,683.44	13,506.32	29,029.51	30,918.05	
2	Net Profit / (Loss) Before Tax	232.60	167.50	108.54	400.10	171.52	
3	Net Profit / (Loss) After Tax	191.85	101.58	79.96	303.43	127.25	
4	Paid-up equity share capital	540.00	360.00	20.00	540.00	20.00	
5	Reserves (Excluding Revaluation Reserves & Government Grant)	2,150.33	227.57	455.99	2,150.33	455.99	
6	Earnings Per Share (EPS) not annulized (FV. Rs. 10/- each)						
- 1	Basic (in Rs.)	4.93	2.82	2.22	7.80	3.53	
- 1	Diluted (in Rs.)	4.93	2.82	2.22	7.80	3.53	

EXTRACT OF STATEMENT OF FINANCIAL RESULTS FOR THE HALF YEAR ENDED

1 The above Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 16 May, 2024. The statutory auditors of the company have carried out limited review of the financia results for the half year ended 31 March 2024.

The Above Financial Results have been prepared in accordance with the applicable Accounting Standards as prescribed u/s. 133 of the Companies Act, 2013 read with relevant provision of the Act as amended and other recognized accounting practices and policies to the extent applicable.

The above is an extract of the detailed format of audited financial results for the half year and year ended 31st March, 2024 filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of the audited financial results for the half year and year ended 31st March, 2024 are available on the Company's website at www.mavankcattlefood.com and on the website of the Stock Exchange at www.bseindia.com

Previous periods / years' figures have been re-grouped / re-classified, where necessary to make it comparable with the curren For, Mayank Cattle Food Ltd.

Place : Rajkot Whole time directior . DIN - 00585290

SCIENCE

JEE (Main) | NEET JEE (Adv.) FOUNDATION

CA - CS માટે FOUNDATION LAW માટે CLAT

M.B.A. માટે IPMAT **UPSC - GPSC**

સ્કૂલ કેમ્પસમાં જ ગર્લ્સ અને બોચઝની અલગ અલગ હોસ્ટેલ સુવિધા...

આજથી જ પ્રવેશ કાર્ચ ચાલુ...

COMMERCE - ARTS

Gujarat Board

RAJKOT - GONDAL

99 7 96 82 22 2

વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોરબંદર–મુંબઈ સૌરાષ્ટ્ર એકસપ્રેસના સમયમાં ફેરફાર

ગુજરાત મિરર, રાજકોટ,તા.૧૭ પોરબંદર યાર્ડ ખાતે પીટ લાઈન બ્લોકની પૂર્ણાહૃતિને ધ્યાનમાં રાખીને રાજકોટ ડીવીઝનમાંથી પસાર થતી ટ્રેન નં.૧૯૦૧૬ પોરબંદર–મુંબઈ સેન્ટ્રલ અને ટ્રેન નંબર ૧૯૦૧૫ મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસના ઉદભવતા ટર્મિનેટિંગ સ્ટેશનને મુંબઈ સેન્ટલની બદલે દાદર સ્ઠેશન કરવામાં આવી રહ્યું છે. આગળની સુચના ન મળે ત્યાં સુધી ટર્મિનલને અસ્થાયી રૂપે મુંબઈ સેન્ટ્રલથી દાદર ખસેડલામાં આવી રહ્યું છે. ટર્મિનલમાં ફેરફારને કારણે ટ્રેનના સમયમાં પણ પરીવર્તન કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

૧) ટ્રેન નંબર ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ દાદર ખાતે ૧૯.૨૦ કલાકે ટર્મિનેટ એટલે કે સમાપ્ત થશે. આ ફેરફાર ૨૦ મે, ૨૦૨૪ થી લાગ્ થશે. અન્ય સ્ટોપેજના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

૨) ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદાર પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ દાદરથી ૯.૩૦ કલાકે ઉપડશે. આ ફેરપાર રર મે, ૨૦૨૪ થી લાગુ થશે. અન્ય સ્ટોપેજના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

ઉપરોકત ઉદ્ઘેખીત ટ્રેનોના સ્ટોપેજ સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indinrail.gov.in-fl મુલાકાત લઈ શકે છે.